

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૨/૨૦૧૫ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૦૨/૧૫

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૨ કેસ કરી, ૨૧ વ્યક્તિઓને ઝડપી, ૪૫૫ લીટર દેશી દારૂ અને ૧ કાર કબજે કરી હતી.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૦૩/૧૫

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણ:-

સમાચાર યાદી નં.૩૦૪/૧૫

શાહીબાગ: રતિલાલ ભલાભાઈ લાલજીભાઈ પરમાર (૨હે. માકુભાઈ ની ચાલી ગિરધરનગર બ્રીજ નીચે શાહીબાગ) એ તા.૧૧/૨/૧૫ નારોજ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૭/૨/૧૫ સાંજના ૭/૩૦ વાગ્યાના સુમારે ઘર નજીકથી પોતાની પુત્રી આરતી બહેન (ઉ.વ.૧૭) ને અજાણી વ્યક્તિ અપહરણ કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એ. એમ દેસાઈ ચલાવે છે.

છેતરપીડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૩૦૫/૧૫

બાપુનગર: દિનેશભાઈ ગણપતભાઈ પટણી (૨હે. સત્યમ ફ્લેટ રાયપુર મિલની બાજુમાં રખિયાલ) એ તા.૧૧/૨/૧૫ નારોજ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે છેલ્લા અઢી વર્ષ થી તા.૩/૧/૨૦૧૪ ના સમયગાળા દરમ્યાન આરોપી (૧) જશીબેન રાજુભાઈ પટણી (૨હે.વૈશાલી ફ્લેટ બાપુનગર) (૨) રાજુભાઈ પોપટભાઈ પટણી (૨હે.સદર) (૩) પવનભાઈ શિવરાજભાઈ દુઆ (૪) વિક્રમભાઈ (જેના પુરા નામ સરનામાની ખબર નથી) (૫) કનુભાઈ ઠાકોર (જેના પુરા નામસરનામાની ખબર નથી) એ ઔડાના સાહેબો તરીકે ઓળખાણ કરાવી તમામ આરોપીઓએ ભેગા મળી દિનેશભાઈને લલચાવીને ઔડાનું મકાન રૂપિયા ૩,૫૦,૦૦૦/-નું હોઈ મકાન સસ્તા ભાવે તથા હપ્તામાં અપાવવાની લાલચ આપી રોકડ રૂપિયા ૮૫,૦૦૦/- લઈ રૂપિયા ૨૦૦/- તથા રૂપિયા.૩૦૦/- ની પહોંચ આપી સરસપુર ખાતે નવા બનતા મકાનોને ઔડાના મકાનો તરીકે બતાવી મકાનોની કોઈ નોંધણી નહીં કરતા દિનેશભાઈને રૂપિયાની પરત માંગણી કરતા રૂપિયા કે મકાન નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.એ.પટેલ ચલાવે છે.

કાઠમ બ્રાન્ચ: નગરાજ બુધ્ધમલજી છાજેડ (ઉ.વ.૭૨) (રહે. સ્વાગત ટાવર, માનવ મંદિર પાછળ, મેમનગર) એ તા.૧૧/૨/૧૫ નારોજ કાઠમ બ્રાન્ચ ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૨/૧૫ સવારના ૧૧/૦૦ થી બપોરના ૩/૨૦ વાગ્યા દરમ્યાન આરોપી મોબાઇલ નંબર +૯૧૯૨૧૧૯૦૪૪૯૨ થી રાહુલ નામના ધારકે નગરાજ છાજેડને ફોન કરી આઇસીઆઇસીઆઇ બેન્કમાથી બોલુ છુ તેમ કહી નગરાજ છાજેડના કેડીટકાર્ડનો નંબર મેળવી રૂપિયા ૫,૦૭૦/- નુ ઇન્ટરનેટ માધ્યમથી ખોટુ ટ્રાન્ઝેક્શન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી બી પી રોજીયા ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૩૦૬/૧૫

વેજલપુર: તસ્મીનબાનુ મોહમદજાવેદ શેખ (રહે.દોરહેમ ફ્લેટ ગુલીસ્થા મસ્જીદ સામે રોય અકબર ટાવર પાસે જુહાપુરા) એ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૨/૧૫ કલાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના મકાનના દરવાજાનુ તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૨,૫૪,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી જ કે પંડયા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર
પોલીસ કમિશનર વતી.